https://archive.org/details/bk1148/page/n0/mode/1up

1959-12-27 -Sandhyapath -by Valdas Maharaj - Manager of -Kachchhi Lalrameshwar Ashram (1148)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

3

પ્રાતઃ સ્મરણમ્

અને

સંધ્યાપાઠ

મુમુક્ષુઓના પઠન, અધ્યયન અને મનન માટે

સંગ્રાહક :
ગુરુશ્રી ઓધવરામજીના શિષ્ય શ્રી વાલદાસજી

વ્યવસ્થાપક : શ્રી કચ્છી લાલરામેશ્વર આશ્રમ, સપ્ત સરોવર,
હરિદ્વાર (યુ. પી.)

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1148/page/n2/mode/1up

realpatidar.com

3

પ્રાતઃ સ્મરણમ્

અને

સંધ્યાપાઠ

મુમુક્ષુઓના પઠન, અધ્યયન અને મનન માટે

સંગ્રાહક :
ગુરુશ્રી ઓધવરામજીના શિષ્ય શ્રી વાલદાસજી

વ્યવસ્થાપક : શ્રી કચ્છી લાલરામેશ્વર આશ્રમ, સપ્ત સરોવર,
હરિદ્વાર (યુ. પી.)

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n3/mode/1up

realpatidar.com

શ્રી ગુરુ દેવાય નમઃ

ગુરૂ ભક્તજનો,

"પ્રાતઃ સ્મરણમ્ અને સંધ્યાપાઠ" ની પુસ્તીકાની પ્રથમ આવૃતી પ્રત ૧૦૦૦ નકલો ખલાસ થઇ જતાં અને તેની માંગ ચાલુહોતાં સુધારા-વધારા સાથે મોટા અક્ષરોમાં બીજી આવૃતીની પ્રત ૨૦૦૦ (ગુજરાતી) ફરીથી બહાર પાડવામાં આવે છે.

મુંબઇ
તા ૫-૧૨-૧૯૫૯

લી. વાલદાસ
ના હરિ ૐ તત્ સત્

પ્રકાશક :

ગુરુ શ્રી ઓધવરામજી સત્સંગ મંડળ

૭૫, નવી બારદાન ગલી, મુંબઇ-૩.

(પહેલી આવૃતિ ગુજરાતી) પ્રત : ૧૦૦૦ પ્રગટ સંવત ૨૦૧૫

(સુધારેલી બીજી આવૃતિ ગુજરાતી) પ્રત : ૨૦૦૦ પ્રગટ સંવત ૨૦૧૬

મુદ્રણ સ્થાન :

ભારતી પ્રિન્ટરી, માટુંગા—મુંબઇ ૧૯.

ટેલીફોન : ૬૧૯૭૫

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n4/mode/1up

realpatidar.com

પૂ. ગુરૂવર્ય

મહારાજ શ્રી ઓધવરામજી

વાંઢાય (ઇશ્વરનગર) કચ્છ તથા હરિદ્વારવાસીની પવિત્ર યાદમાં

જન્મ : ચૈત્ર શુકલ પક્ષ ૯ રામનવમી સં. ૧૯૪૫

દેહોત્સર્ગ

પોષ સુદી ૧૨ રવીવાર મકર સંક્રાંતિ સં. ૨૦૧૩ તા. ૧૩-૧-૫૭

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n5/mode/1up

realpatidar.com

પૂજ્યપાદ બ્રહ્મવિદ્વરિષ્ટ પૂ. ગુરૂવર્ય

મહારાજ શ્રી ઓધવરામજી



વાંઢાય (ઇશ્વરનગર) કચ્છ તથા હરિદ્વારવાસીની પવિત્ર યાદમાં

જન્મ : સં. ૧૯૪૫ ચૈત્ર શુદ ૯ (રામનવમી)

દેહોત્સર્ગ:

સં. ૨૦૧૩ પોષ સુદી ૧૨ રવીવાર (મકર સંક્રાતિ) તા. ૧૩-૧-૫૭

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n6/mode/1up

realpatidar.com

બીજી આવૃત્તીની પ્રસ્તાવના.

શ્રી ગુરૂ દેવાય નમઃ

સુજ્ઞ ભક્તજનો,

પૂજ્ય મહારાજશ્રી ઓધવરામજી હરિદ્વાર આશ્રમમાં નિત્ય આરતી. પાઠ, સંધ્યા, ભજનો વિગેરે જે રીતે કરાવતા તે રીતે આજે પણ નિયમસર ચાલુ છે.

આ "પ્રાતઃ સ્મરણમ અને સંધ્યા" પાઠ પુસ્તક આશ્રમ પ્રેમી ભાઇ-બ્હેનો અને પૂજ્ય ગુરૂશ્રી ઓધવરામજી મહારાજના ભક્તજનોના આગ્રહને વશ થઇ બહાર પાડવામાં આવેલ છે. એના પ્રકાશન માટે જે સંતપ્રેમી ભાઇઓએ પરિશ્રમ લીધો છે તે પ્રશંસનિય છે; તેમને ધન્યવાદ ઘટે છે એટલુંજ નહિ પણ આવા જ્ઞાન-પ્રસારના કાર્ય માટે તેઓએ જે શ્રી, શ્રમ અને શક્તિ કામે લગાડયાં છે તે વૃક્ષ થઇ ઉગે એવી મારી ભાવના છે. અંતમાં આ પુસ્તીકામાં રહી ગયેલ ભુલચુક તથા ક્ષતિઓ બદલ આપ મોટું મન રાખી દરગુજર કરશો અને સુધારી વાંચશો. (શુદ્ધિપત્રક અન્યત્ર છાપેલ છે તે પ્રમાણે ભુલો સુધારી લેવી.)

માટુંગા-મુંબઇ
શનિવાર તા. ૨૭-૧૨-૫૯
સં. ૨૦૧૬, માગશર વદ ૧

લી. વાલદાસ
ગુરૂશ્રી ઓધવરામજી
શ્રી કચ્છી લાલરામેશ્વર આશ્રમ,
સપ્ત સરોવર, હરિદ્વાર (યુ. પી.)

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n7/mode/1up

realpatidar.com

શ્રી કચ્છી લાલરામેશ્વર આશ્રમ

સપ્ત સરોવર, હરિદ્વાર (યુ. પી)

સંક્ષિપ્ત પરિચય :

કચ્છની અને અન્ય જનતા માટે નિવૃત્તિમય અને શાંતિમય
જીવન જીવવાનું, આ રમ્ય ગંગા કિનારે નિસર્ગની ગોદમાં આવેલું,
હરદ્વાર સ્ટેશનથી ૪ માઇલનાં અંતરે,
શ્રી સપ્તઋષી આશ્રમ – મંદીર – ની સામે, પવિત્ર તીર્થસ્થાન
શ્રી કચ્છી લાલરામેશ્વર આશ્રમ.

સ્થાપના : **સને ૧૯૫૫**

સ્થાપક : **પૂજ્ય ગુરૂ મહારાજ શ્રી ઓધવરામજી**

વ્યવસ્થાપક : **સાધુ વાલદાસજી ગુરુશ્રી ઓધવરામજી**

સંચાલક ટ્રસ્ટી અને સલાહકાર સમિતિના પ્રમુખ :
શ્રી હરિદાસ વેલજી

મુંબઇ ઓફીસ :
ઠે. શ્રી પ્રેમજી હરિદાસ ની કાં.
ભાનુશાલી ચેંબર્સ – દાણાબંદર, **મુંબઇ ૯.**

વધુ માહિતી માટે **હરદ્વાર** અથવા **મુંબઇ** ઓફીસે તપાસ કરવી.

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n8/mode/1up

realpatidar.com

प्रातः स्मरणम्

प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्वम् ।
सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् ॥
यत् स्वप्न जागरसुषुप्तमवैति नित्यम् ।
तद ब्रह्म निष्कलमहं न च भूतसंघ ॥१॥

प्रातर्भजामि मनसो वचसामगम्यम् ।
वाचो विभांति निखिला यदनुग्रहेण ॥
यन्नेतिनेति वचनैर्निगमा अवोचु ।
स्तं देव देव मजमच्युतमाहुरग्रयम् ॥२॥

प्रातिनमामि तमस : परमर्कवर्णम् ।
पूर्णसनातनपदं पुरुषात्तमाख्याम् ॥
यस्मिन्निदं जगदशेजमशेषमर्तौ ।
रज्जूत्वांभुजंगमइव प्रतिभासितंवै ॥३॥

श्लोक त्रयमिदं पूण्य, लोकत्रय विभूषणम ।
प्रातःकाल पठेद्‌यस्तु, सगच्छेत परमंपदम ॥

પ્રાતઃ સ્મરણમ્‌ના શ્લોકોના અર્થ

realpatidar.com

realpatidar.com

(૧) સવારના પહોરમાં. સચ્ચિદાનંદ, પરમહંસોની ગતિરૂપ અને તુરિય (ચોથી અવસ્થા) સ્વરૂપ, અંતઃકરણમાં સ્ફુરતું જે આત્મ તત્વ છે (તેનું) હું સ્મરણ કરું છું, (જે) આત્મતત્વ સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તીને જાણે છે, નિત્ય છે, નિરવયવ છે તે બ્રહ્મ તત્વ હું છું. અને પાંચ ભૂતોનો સમુહ હું નથી.

(પ્રાતઃ જીજ્ઞાસુ અવસ્થામાં)

(૨) મન વચનથી પહોંચી શકાય નહિ એવા, જેના અનુગ્રહથી બધી વાણી પ્રકાશે છે, જેને વેદો "નેતિ નેતિ" ("તે આ નહિ - તે આ નહિ") વચનો વડે કહે છે (વર્ણવે છે) અને બ્રહ્મવેતાઓ જેને દેવોના દેવ, અજન્મા, અવિનાશી (અને) મુખ્ય કહે છે, તેને સવારમાં હું ભજું છું.

(૩) અજ્ઞાન (અવિદ્યા) થી પર, સ્વયંપ્રકાશ, પૂર્ણ સનાતન પુરુષોત્તમ નામ જેમનું છે એવા (અને) સંપૂર્ણ મૂર્તિ સ્વરૂપ જેમનામાં આ સંપૂર્ણ જગત રજ્જુ (દોરડી) માં સર્પની પેડે ભાસે છે (તે પરમાત્માને) સવારમાં હું નમું છું.

આ પુણ્યરૂપ અને ત્રિલોકીના ભુષણરૂપ ત્રણે શ્લોકોનો જે (કોઇ) સવારમાં (જીજ્ઞાસુ-મુમુક્ષુ અવસ્થામાં) પાઠ કરે છે તે (ભણે-વાંચે-વિચાર કરી અમલમાં મુકે તે) પરમપદને પામે છે.

શ્રી શંકરાચાર્યના સદાચાર સ્તોત્રનો શ્લોક ત્રીજો :—

प्रातः स्मरामि देवस्य सवितुर्भर्ग आत्मनः ।
वरेण्य तत् धियो येनः चिदानंदः प्रचोदयात् ॥

જે જ્ઞાન અને આનંદસ્વરૂપ (આત્મા) અમારી બુદ્ધિને પ્રેરે છે (સત્તા સ્ફુર્તિ આપે છે) તે આત્મારૂપ સવિતા (સુર્ય) દેવના શ્રેષ્ઠ તેજને હું પ્રાતઃકાલમાં સ્મરૂં છું (સ્મરણ કરૂં છું.)

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n10/mode/1up

realpatidar.com

શાંતિ પાઠ

ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં, પૂર્ણાત્ પૂર્ણ મુદચ્યતે ।
પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણમેવા વશિષ્યતે ॥
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

અર્થ : તે સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ (પુરૂષોત્તમ) સર્વ પ્રકારે સદા સર્વદા પરિપૂર્ણ છે. આ (જગત) પણ તે પરબ્રહ્મથી પૂર્ણ છે. કારણ કે આ પૂર્ણ (જગત) તે (પરબ્રહ્મથી) પૂર્ણ થયેલું છે. પરબ્રહ્મની પૂર્ણતાથી જગત પૂર્ણ છે, તેથી તે પરિપૂર્ણ છે. તે પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ કાઢી લેતાં પણ તે પૂર્ણજ બચે છે (બાકી રહે છે).

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

(ૐ ત્રિવીધતાપ (અધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવીક તાપ) ની શાંતિ થાઓ)

શ્રી ગાયત્રી મંત્ર

ૐ भूर्भुवः स्वः
ॐ तत्सवितुर्वरेण्यम् भर्गोदेवस्य धीमहि ।
धियोयोनः प्रचोदयात ॐ ॥

ત્રિપદા-ત્રણ પદવાળી. ગાન-જપ કરનારને તારનાર-ગાયત્રી

ૐ ભુઃ- પ્રાણ, ભુવઃ- અપાન, સ્વઃ- વ્યાન

ૐ જે અમારી બુદ્ધિને પ્રેરે છે (સત્તા સ્ફુર્તિ આપે છે) તે સવિતા (સુર્ય) દેવતા શ્રેષ્ઠ તેજનું અમે ધ્યાન કરીએ છીએ.

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n11/mode/1up

realpatidar.com

શ્રી ગુરૂ મંત્ર

શ્રી ગુરૂ દેવાય નમો નમઃ

શ્રી ગુરૂ ઇશ્વરરાય નમો નમઃ

શ્રી ગુરૂ લાલરામાય નમો નમઃ

શ્રી ગુરૂ ઉધ્ધવરામાય નમો નમઃ

कराग्रे वसते लक्ष्मी, करमुले सरस्वती ।
करमध्ये तु गोविंदः प्रभाते करदर्शनम् ॥

कृष्ण त्वदीय पदपंकजपंजरान्तम्
अद्यैव मे विशतु मानसराजहंसः ।
प्राण प्रयाण समये कफवातपित्तैः
कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते ॥

त्वमेव माता च पिता त्वमेव
त्वमेव बंधु-श्च सखा त्वमेव ।
त्वमेव विद्या द्रविणं त्वमेव
त्वमेव सर्वं मम देव देव ॥

गोविंद गोविंद हरे मुरारे
गोविंद गोविंद रथांग पाणे ।
गोविंद गोविंद मुकुंद विष्णो
गोविंद गोविंद नमो नमस्ते ॥

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n12/mode/1up

realpatidar.com

ભજન

(રાગ : પરજ-તાલ દીપચંદી)

ધરજે ધરજે હરિનું ધ્યાન, ધીરજ મન આણીરે,
મૃગજળ જેવો આ સંસાર, એવું નિશ્ચે જાણીરે—ટેક

સ્વાર્થ સારૂ કરે સૌ સ્નેહ, જગતની એ રીતીરે,
વિશ્વનાથ વિષે ચિત્તધાર, પૂરણ કર પ્રીતિરે—૧

સમજી લેવું ચતુર સુજાણ, માયા ઠાઠ ખોટારે,
એને જાતાં ન લાગે વાર, પાણી પરપોટારે—૨

આ છે ચંચલ ચપલા જેમ, આયુ અસ્થિર તારીરે,
અંતે જાવું એકા એક, હરિ લે સંભારીરે—૩

એવું સમજી ચેત અચેત, પ્રભુ સ્મરણ કરવુંરે,
એમ કહે છે ઓધવરામ, બીજું પરિહરવુંરે—૪

આરતી

આનંદ મંગળ કરૂં આરતી, હરિગુરૂ સંતની સેવા—ટેક
પ્રેમ ધરી મંદીર પધરાવું, સુંદર સુખડાં લેવા—આનંદ—૧
અડસઠ તીરથ સંતોને ચરણે, ગંગા, જમુના, રેવા—આનંદ—૨
જેને આંગણ તુલશીનો કયારો, શાલિ ગ્રામની સેવા—આનંદ—૩
કહે પ્રિતમ જેને હરિ છે વહાલા, હરિના જન હરિ જેવા—આનંદ—૪
બાઇ મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ ચરણ કમલ ચિત્ત લેવા—આનંદ—૫

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n13/mode/1up

realpatidar.com

શ્રી ગુરૂ અષ્ટકમ

શરીરં સુરૂપં તથા વા કલત્ર,
યશશ્ચારૂ ચિત્રં ધનં મેરૂ તુલ્યંમ્ ॥
ગુરો રંધ્રી પદ્મે મનશ્ચેન લગ્નં,
તતઃ કિં તતઃ કિં તતઃ કિં તતઃ કિં
(હરેરંધ્રી–ગુરોરંધ્રી)

કલત્રં ધનં પુત્ર પોત્રાદિ સર્વં,
ગૃહં બાંધવાઃ સર્વં મેતધ્ધી જાતમ્.–ગુરોરંધ્રી

ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા
કવિત્વાદિ ગદ્યં શુ પદ્યં કરોતિ

વિદેશેષુ માન્યઃ સ્વદેશેષુ ધન્ય
સદાચાર વૃત્તેષુ મત્તો ન ચાન્ય
ગુરોરંધ્રી પદ્મે મનશ્ચેન લગ્નં
તતઃ કિં તતઃ કિં તતઃ કિં તતઃ કીં

ક્ષમા મંડલે ભુપ ભુપાલ વૃન્દે
સદા સેવિતં યસ્ય પાદાર વિંદમ્

યશોમેગતં દિક્ષુ દાન પ્રતાપાત્
જગદ વસ્તુ સર્વં કરે યત્પ્રસાદાત

ન ભોગે ન યોગે ન વા વાજિ રાજૌ
ન કાન્તા મુખે નૈવ વિત્તેષુ ચિત્તમ્

અરણ્યે ન વા સ્વસ્ય ગેહે ન કાર્યે
ન દેહે મનો વર્તતે મે ત્વનર્ધ્યે

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n14/mode/1up

realpatidar.com

અનર્ઘ્યાણિ રત્નાનિ ભુકતાનિ સમ્યક
સમા લિગિતા કામિની યામિનીષુ
ગુરોરંઘ્રો પદમે મનશ્ચેન લગ્નં
તતઃ કિં તતઃ કિં તતઃ કિં તતઃ કિં

ગુરોરષ્ટકં યઃ પઠેત્પુણ્ય દેહી
યતિ ભુંપતિ બ્રહ્મચારી ચગેહી
લભેદ્વાંછિતાર્થં પદં બ્રહ્મ સંજ્ઞં
ગુરો રુકત વાકયે મનો યસ્ય લગ્નં

શ્રી ગુરૂ અષ્ટકમ્‌નો અર્થ (સાર)

૧ રૂપયુકત શરીર, સુંદર સ્ત્રી, નિર્મલ મહાન યશ તેમજ સોનાના સુમેરૂ પર્વત જેટલું ધન પ્રાપ્ત હોય, છતાં પણ જો શ્રી ગુરૂદેવના ચરણ કમલમાં મન લાગેલું ન હોય તો તે રૂપાળા શરીરથી શું? કંઇ પણ નહિ.

૨ સ્ત્રી, ધન, અને પુત્ર પોત્રાદિ સર્વ તેમજ, ઘર અને બાંધવો એ બધું પ્રાપ્ત હોય,

૩ શિક્ષા, વ્યાકરણ, નિરૂકત છંદ અને જયોતિષ એ છ અંગો સહિત ચાર વેદ, પૂર્વ મીમાંસા, ઉતર મીમાંસા, સાંખ્યયોગ, ન્યાય અને વૈશેષિક એ છ શાસ્ત્ર તેમજ ચોદ વિદ્યા મુખપાઠ હોય અને કવિત્વાદિ ગદ્ય તથા પદ્યની રચના કરી જાણનો હોય,

૪ જે વિદેશો વિષે સુમાનનીય હોય અને સ્વદેશ વિષે પ્રસંશાવાળો હોય તેમજ સાધારણ જનોમાં નહિ પણ સદાચારી પુરૂષોમાં જે પોતાના સદાચારીપણાનો પૂર્ણ ગર્વ ધરાવનાર હોય,

૫ પૃથ્વી મંડળ પર અનેક રાજાઓ અને મહારાજાઓ વડે જેના ચરણ કમલ સદા સેવાતા હોય,

૬ દાનના પ્રતાપથી મારૂં યશ દશો દિશામાં વ્યાપ્ત છે અને તેના પ્રભાવથી જગતની સર્વ વસ્તુઓ મારા હાથમાં પ્રાપ્ત છે, એમ પોતાને માનનાર હોય,

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n15/mode/1up

realpatidar.com

૭ જેનું ચિત્ત ભોગ આશકત નથી, અષ્ટાંગ યોગમાં આસકત નથી, મોટા મોટા ઘોડાઓમાં આશકત નથી, સુંદર સ્ત્રીના મુખમાં આશકત નથી, તેમજ પૈસામાં પણ આશકત નથી એવો પોતે વિરકત હોય,

૮ મારૂં મન મારા ઘરમાં નથી. કોઈ કાર્યમાં નથી, દેહમાં નથી, તેમજ મારૂં મન કોઇ અમૂલ્ય પદાર્થમાં પણ નથી, કેવલ અરણ્યમાં આનંદ માનનારૂં છે. એમ માનનારો હોય,

અમુલ્ય રત્નો સારી રીતે ભોગવ્યા હોય અને અનેક રાત્રિઓ વિષે અતિ સુરમ્ય મનોહર સ્ત્રીં આલિંગન અપાયેલી હોય,

ઉપરોકત બધું હોય છતાં જો શ્રી ગુરૂદેવના ચરણ કમલમાં મન પ્રિતીત્રણું અનુરકત – આશકત – ભકિત યુકત ઓતપ્રોત ન હોય તો ઉપરોકત બધું પ્રાપ્ત હોય તેથી શું? તેથી શું? તેથી શું? તેથી શું? અર્થાત કંઇ પણ નહિ.

સંન્યાસી, રાજા, બ્રહ્મચારી, કે ગૃહસ્થ ગમે તે હોય પણ જે પુણ્યાત્મા શ્રી ગુરૂદેવના અષ્ટકમનો એટલે ઉપરોકત શ્લોકોનો પાઠ કરે છે અને તેનું મન શ્રદ્ધા વિશ્વાસપૂર્વક શ્રી ગુરૂદેવના ઉકત વાકયોમાં લાગેલું છે, તેને વાંછિત વસ્તુ બ્રહ્મતત્વ એટલે મોક્ષ પ્રાપ્ત થાય છે.

શ્રી ગીતાજીની આરતી

ૐ જય ભગવદ્ગીતે (દેવી) જય ભગવદ્ગીતે
હરિ હિય કમલ વિહારીણી, સુંદર સુપુનીતે — ૐ જય

કર્મ-સુમર્મ-પ્રકાશીની, કામા શકિત હરા
તત્વજ્ઞાન-વીકાશીની, વિદ્યા બ્રહ્મપરા — ૐ જય

નિશ્ચલ ભાકત વિધાયીની, નિર્મલ મલ હારી
શરણ-રહસ્ય-પ્રદાયીની, સબ વિધિ સુખ કારી — ૐ જય

રાગ દ્વેષ વિદારીણી, કારીણી મોહ સદા
ભવ ભય-હારીણી તારીણી, પરમાનંદ પ્રદા — ૐ જય

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n16/mode/1up

realpatidar.com

આસુર ભાવ-વિનાશીની. નાશીની તમ-રજની
દૈવી સદગુણ દાયીની, હરી રસીકા સજની — ૐ જય

સમતા-ત્યાગ શીખાવની, હરી મુખ કી બાની
સકલ શાસ્રકી સ્વામીની. શ્રુતીયોંકી રાની — ૐ જય

દયા-સુધા બરશાવની. મા તુ! કૃપા કીજૈ
હરી-પદ-પ્રેમ દાનકર, અપનો કર લીજૈ — ૐ જય

ધુન

જય ગુરૂ જય ગુરૂ બલિહારી
અલખ નીરંજન નીર્વાણી

જય ગુરૂ જય ગુરૂ જય ગુરૂ દેવ
નાથ નીરંજન જય ગુરૂ દેવ

જય ગુરૂ જય ગુરૂ સચ્ચિદાનંદ
જય ગુરૂ જય ગુરૂ પરમાનંદ

જય ગુરૂ જય ગુરૂ શ્રી ઓધવરામ
શ્રી લાલરામ ગુરૂ શ્રી ઇચ્છારામ

ધુન

શીવોહં શીવાહં સચ્ચિદાનંદોહંમ્
રામોહં રામોહં પુર્ણાનંદોહંમ્
કૃષ્ણોહં કૃષ્ણોહં ચિદ઼ ઘના નંદોહંમ્
સૂર્યોહં સૂર્યોહં જ્યોતિ સ્વરૂપોહંમ્
સોહં હંસા કેવલરામ બ્રહ્મેવાહં શ્રી ભગવાન

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n17/mode/1up

realpatidar.com

ભજન

નારાયણ દીન દયાલરે, ભજમન રાધે ગોવીંદા
નારાયણ તેરો આધારેરે, ભજમન રાધે ગોવીંદા

માયા મેં મન કયોં ભરમાયે, સાથ ન તેરે કોડી જાયે
જાયેગા હાથ પસારરે, ભજમન રાધે ગોવીંદા

જીવનકા કુછ નહિ ઠીકાના, ચલે ન કાલસે કોઇ બહાના
કુછ તો સોચ વિચાર રે, ભજમન રાધે ગોવીંદા

મનવા કરલે અબ સત સંગતિ, બન જાયેગી તેરી શુભ ગતી
બેડા લગેગા તેરા પાર રે, ભજમન રાધે ગોવીંદા

સંધ્યા પાઠ

ૐ શ્રી સદગુરૂ સ્તવન માલા

ચૈતન્યં શાશ્વતં શાંતં, વ્યોમાતીતં નિરંજનં
નાદ બિંદુ કલાતીતં, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

સર્વ શ્રુતિ શિરોરત્ન, વિરાજીત પદાંબુજેમ્
વેદાંતા બુજ માર્તંડેમ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

અજ્ઞાન તિમિરાંધસ્ય, જ્ઞાનાંજન શલાકયા
ચક્ષુરુન્મિલિત યેન, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણું, ગુરૂ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

ધ્યાન મૂલં ગુરો મૂર્તિ, પૂજા મૂલં ગુરોઃ પદમઃ
મંત્ર મૂલં ગુરોર્વાકયં, મોક્ષમૂલં ગુરોઃ કૃપાઃ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

અખંડ મંડલા કારં, વ્યાપ્તં યેન ચરાચરમ:
તત પદમ્ દર્શિતં યેન, તસ્મૈ શ્રી ગુરવે નમ:

ન ગુરોરધિકં તત્વં, ન ગુરોરધિકં પરમ્
ગુરોઃ પરતરં નાસ્તિ, તસ્માત્સંપૂજ્યતે ગુરુઃ

અખંડાનંદ બોધાય, શિષ્ય સંતાપ હારિણે
સચ્ચિદાનંદ રુપાય, સમાય ગુરવે નમ:

અજ્ઞાન મુલ હરણં, જન્મ કર્મ નિવારણંમ્
જ્ઞાન વૈરાગ્ય સિદ્ધયર્થં ગુરુ પાદોદકં પિબેત

બ્રહ્માનંદં પરમ સુખદં, કેવલં જ્ઞાન મુર્તિં
દ્વંદ્વાતીતં ગગન સદશં, તત્વ મસ્યાદિ લક્ષ્યમ્

એકં નિત્યં વિમલ મચલં, સર્વધી સાક્ષિભુતં
ભાવાતીતં ત્રિગુણ રહિતં, સદગુરું તં નમામિ

સોરઠા

વસ્તુ ગતે સો એક, થામે કછુ એ ભિન્ન નહિ
હરિ ગુરૂ સંત વિવેક, નામ મનોહર સુર કહે

છંદ નારાચ

હરિ ગુરૂ જો એક હૈ, વિવેક સોં વિચારજે
કરી કૃપા કૃપાલકી, જો આપકો ઉધારજે
લહે જુ ભેવ જ્ઞાનકો, અજ્ઞાન અંતરા તજે
અખંડ રૂપ આતમા, ભલીજુ પ્રીતસોં ભજે

ન દુર હૈ નજીકસો, ન નીલ પીત રંગ હૈ
ન શ્વેત શ્યામ કો કહે, ન બાલ વૃદ્ધ અંગ હૈ
ન પાર હૈ અપાર કો, ન વૈખરી પિછાનહીં
સદા અસંગ આતમા, પરાત પાર માનહીં

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n19/mode/1up

realpatidar.com

કયોં પરાત પાર હૈ, લખે ન કોઇ ભેવકો
અનામયં અચિંત હૈ, દશ્યો ન જાત દેવકો
અગાધ સંતકો મતો, કથ્યો ન જાત કયોં કહે
યથામતી જુ ભાખહીં, લખ્યો ન જાત કયોં લહે

ગુરૂ જબે કૃપા કરે, તબે શુતત્વ કો લહે
મિટે અજ્ઞાન આન કો, દુરીતકો દુરી દહે
લખેજુ સાચ સારકો, અસારકો ન ધારહી
ગ્રહીજુ જ્ઞાન કેવલં, અજ્ઞાનકો નિવારહી

લખ્યો સ્વરૂપ બ્રહ્મકો, ચરાચરં જુ દેખહી
ભિન્ના ભિન્નં ન ભાવ હૈ, ન કાહુ કો ઉવેખહી
હરી હરી જુ દર્શહી, હરી વિના ન આન હૈ
હરી હરી જપે સદા, હરી હરી સુધ્યાન હૈ

હરી હરી જુ બોલહી. હરી હરી સુધ્યાવતે
હરી હરી બખાનહી. હરી હરી સુ ગાવતે
હરી હરી જુ ચિંતવે, હરી હરી સુ માનતે
હરી હરી જુ વંદહી. હરી હરી પિછાનતે

અચિંત રૂપ આતમા, સ્વરૂપ સો ધરે સદા
વૃત્તી અડોલ વારધી, ન કાહુપે ચલે કદા
તપે રવિ નિદાઘકો, કછુ ન ઉષ્ણ લાગહી
મતો અપાર જ્ઞાનકો, જુતાહીકો ન ત્યાગહી

પ્રમાણિકા છંદ

ન કામ ક્રોધ લોભ હૈ. ન શોભ હૈ અશોભ હૈ
ન મોહ દ્રોહ કો કરે, ન ભેદ ભાવના ધરે
સબેજુ દ્વૈત ત્યાગહી, ન સંગ દોષ લાગહી
તજે ન વેદ આમ્નના, કરે ન મન કામના

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n20/mode/1up

realpatidar.com

દોહા

જ્ઞાની ગુરૂ કો વંદીયેં   જુગલ જોરી કે પાન
રવિ હરત જયોં તિમિરકો   ગુરૂ હરે અજ્ઞાન
પ્રાપતિ જે પરી બ્રહ્મકી   જાકે વચન તેં હોય
તાકી પદરજ પરશિયેં   ગુરૂ સમ આનન કોય
જિનહી કે અજ્ઞાન કરી   ભાસત માયા ભાસ
સત્ય સ્વરૂપ કે જ્ઞાન તેં   દિસે બ્રહ્મ વિલાસ
જ્ઞાની કે ઉપદેશ તેં   મિલે પરી બ્રહ્મ રાય
દેવા ગુરૂ ધન ધન્ય હૈ   વંદન યોગ્ય સદાય
પ્રથમ કરોં કર જોરિકે   ચરન કમલકી સેવ
વિઘ્ન હરે મંગલ કરે   જય જય જય ગુરૂદેવ
જો પરહીં ગુરૂ ચરનમેં   સો તરહી તતએવ
સો ફીર ઉદર ન આવહી   જય જય જય ગુરૂદેવ
ગુરૂ બિન સંશય ના મિટે   ગુરૂ બિન મિલે ન ભેવ
ગુરૂ બિન જ્ઞાન ન ઉપજે   જય જય જય ગુરૂદેવ
જ્ઞાની ગુરૂ પ્રસાદ તેં   પરી ભજનકી ટેવ
લાગી લગન લોચન ખુલે   જય જય જય ગુરૂદેવ
પરા પાર પરિબ્રહ્મ જે   અખંલ અખંડ અભેવ
તિન વપુધરી કરૂણા કરી   જય જય જય ગુરૂદેવ
ધરે ધ્યાન ગુરૂદેવ કો   ધ્યાવે અંગ અવેવ
શો પાવે મહામુકિત સુખ   જય જય જય ગુરૂદેવ
ભયો પ્રકાશ હી બ્રહ્મ કો   ગયો શકલ અહમેવ
અંતર ઉદયો આતમા   જય જય જય ગુરૂદેવ
ગુરૂ સોઇ પરિ બ્રહ્મ હૈ   ગુરૂ નિરંજન એવ
વિહારી પદ વંદન કરે   જય જય જય ગુરૂદેવ

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n21/mode/1up

realpatidar.com

ચોપાઈ

નમો નમો ગુરૂદેવ ગુસાંઈ　　મૈં આયો તુમરી સરનાઇ
તાતેં કરો વિનય કરજોરી　　નાથ યથા મતિ સામરથ મોરી
પશ્ચીમ ખંડ ધરા કચ્છદેશ　　તહાં સદ્‌ગુરૂ દેહ ધર્યો નરેશ
હમલા ગામ સુથાનકવાસા　　જહાં સુખ પાવે સંત નિવાસા
તહાં પ્રગટે ગુરૂ સાહેબ દેવા　　પૂરન બ્રહ્મ અખંડ અભેવા
યાદવ કુલમેં ભયે અવતાર　　જીવ અનેક ઉધારન હારા
જન્મ ધર્યો જીવનકે કારન　　તાહો સદ્‌ગુરૂ આયે તારન
માતપિતા કુલકુટુંબ પરિવારા　　તાકો સદ્‌ગુરૂ તારનહારા
ધનધન માતપિતા ધન બંધુ　　જાઘર પ્રગટે કરૂણા સિન્ધુ
ધન સો નગર વસેજા માંહીં　　તામે લોક વસે ધનતાહીં
ધન ધન શિષ્ય કરે જો સેવા　　તા પર કૃપા કરે ગુરૂદેવા
સેવક સંગ રહે સો ધન હૈ　　જાકો રાતદિવસ દરશન હૈ
ધનધન ભૂમિ જહાં વિચરહી　　તા ભૂમિકો પાવન કરહી
જો કોઇ ચંદન પુષ્પ ચઢાવે　　તો પ્રિયતા મનમેં નહિ આવે
જોકોઈ કુટીલ વચન મુખ દાખે　　તાકો દોષ હદે નહિ રાખે
શીતલ શાંત સદા સ્થિર માના　　બ્રહ્મ વિના દેખે નહિ આના
બ્રહ્મ ભાવ કરી બ્રહ્મ પિછાન્યો　　બ્રહ્મ રૂપ આપ એક કરી જાન્યો
તાતે બ્રહ્મ રૂપ ગુરૂદેવા　　અકલ અખંડ અનંત અભેવા
જો નિર્ગુંન નિર્ભેદ નિરંજન　　સો મેરે ગુરૂ ભવદુખઃ ભંજન
એક અજન્મા જો અવનાશી　　સો મેરે સતગુરૂ સુખરાસી
એક અખંડીત અકલ અમાપક　　સો મેરે ગુરૂ ઘરઘર વ્યાપક
જો ચિદ્રુપ ચલે નહિ ડોલે　　સો મેરે ગુરૂ ઘટઘટ બોલે
જો વ્યાપક જલથલકે માંહિ　　સો સદ્‌ગુરૂ દુજા કો નાહિ
તાંતે એક આદિ મધ્ય અંત　　સદ્‌ગુરૂ આપ સ્વયં ભગવંત
ગુરૂ ગોવિંદ ગુરૂ સોઇ રામા　　એહિ રૂપ ધર્યા દોઇ નામા
દેવા સદ્‌ગુરૂ સાહેબ મેરા　　ભેટત ચરન મિટયા ભવ ફેરા
દેખી દીન દયા મન આની　　કરી કૃપા જન અપનો જાની
જન વિહારી ગુરૂ મહિમા ગાવે　　સકલ સંતકો શીશ નમાવે

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n22/mode/1up

realpatidar.com

દોહા

વ્યાપક સબ ઘટ આતમા   જાકો આદિ ન અંત
સો મેરે ઉર નિત વસે   જય જય ગુરૂ ભગવંત

જાકો ગાવત વેદ નિત   અકલ અખંડ અનંત
સો મેરે નજ આતમા   જય જય ગુરૂ ભગવંત

જુઠા કાલ્પત જન વધે   સકલ ચરાચર જંત
સમરથ એસે સબન મેં   જય જય ગુરૂ ભગવંત

સબજડ ઇંદ્રિય જિન હિતે   વોહી ચૈતન વરતંત
સોઇ પ્રગટ પરમાત્મા   જય જય ગુરૂ ભગવંત

ખોજયા જિન ખાંખત કરી   તિન પાયા નિજ તંત
પાયા ગુરૂ પ્રસાદ તેં   જય જય ગુરૂ ભગવંત

ગુન નિર્ગુન નહિ જિનવિષે   સોઈ સબ ગુનવંત
તબસો દુજા કયા કહે   જય જય ગુરૂ ભગવંત

ઐસે આતમ તત્વ કો   જો સમજે સો સંત
સો ઉત્તમ હૈ સબ નિતેં   જય જય ગુરૂ ભગવંત

સમજયા સમજી ત્યાં શમ્યા   માનુ ભાવ મહંત
વિહારી વંદન યોગ્ય હૈ   જય જય ગુરૂ ભગવંત

ચોપાઈ

દિનકો પઠન પ્રાતઃ ઉઠી કરહી   ગુરૂકે ચરન કમલ ચિત ધરહી
યહ ગુરૂ મહિમા સુને સુનાવે   તાકો ફેર જન્મ નહિ આવે

કુંડલિયા

દેવા યહ વર દીજિયે   ઉપજે આતમ જ્ઞાન
ચરન તુમારે ચિત વસે   ધરે નિરંતર ધ્યાન
ધરેં નિરંતર ધ્યાન   અવર ઇચ્છા નહિકોઇ
દુર્લભ યહ વરદાન   દયા કરી દીજે સોઇ
કહે વિહારી કર જોડ   સદા સંતનકી સેવા
ઉપજે આતમજ્ઞાન   દીજિયે યહ વર દેવા

(પરંપરા ગુરૂ પધ્ધતિના દોહા "શ્રી ઈશ્વર વિહારી વિલાસ" ચોપડીમાં જોવા.
મહારાજ શ્રી ઓધવરામજી હરિદ્વાર આશ્રમમાં જે રીતે બોલવના તે અહિં લખેલ છે)

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n23/mode/1up

realpatidar.com

દોહા

પતિત ઉધ્ધારન મહાપ્રભુ   દયા સિન્ધુ ગુરૂદેવ
સેત્રારામ યાચે સદા   ચરન કમલકી સેવ
ચરન કમલકો ધ્યાન પ્રભુ   દીજેં દ્રઢ ઉરમાંહિ
યાચક યાચત શ્રી ગુરૂ   ભીખ એહિ તુમ પાંહિ
તુમ દાતા સબ લોકકે   સદ્‌ગુરૂ સદા કૃપાલ
ભાવ ભક્તિ ભીક્ષા ચહોં   દીજેં દીન દયાલ
ભટકિ ભટકિ દેખે સભી   દેવી દેવ અપાર
ઉલટે બંધન મેં પરે   કોઇ ન છુડાવન હાર
ભ્રમત ભ્રમત આઇ પર્યો   સદ્‌ગુરૂ તો દરબાર
કૃપા દ્રષ્ટિ કીજે પ્રભુ   પકડી ઉતારો પાર
તુમબિન હમરો કોઉ નહિં   અવર વસીલો કોય
તાતે સદ્‌ગુરૂ રાખીંયે   શરન આપની મોય
સદા હમારે ચિત બસે   બિસરોન એક લગાર
તુમ પેં માગું શ્રીગુરૂ   તુમરો ધ્યાન ઉચાર
તુમરે યશ નિત ગાવહોં   તુમરે ગુન અરૂ ગીત
સદ્‌ગુરૂ તુમરે પાદસોં   ઉમંગે નિત નિત પ્રીત
કુંજી ઇંડા જયોં તજે   આપ વસે પરદેશ
સદ્‌ગુરૂ એસેં રાખીઆ   સુરતી માંજ હંમેશ
શુરત બિના નિપજે નહિં   શિશુ ઇંડા ગલી જાય
તાતે તુમહિ દયાલ ગુરૂ   હોજો સદા સહાય
પ્રાર્થના યહ જો કરી   સદ્‌ગુરૂ ધરજો કાંન
સેવારામ પ્રણવે સદા   મેરે જીવન પ્રાણ
દેવા દરશન દિલહિ મેં   પલ પલ દીજે મોહિ
એક નિમિષ નહિ ભૂલહોં   સ્વામી હમિહી તોહી
સુરત તુમારી સદ્‌ગુરૂ   છિન એક બિસરત નાહિં
માહલાલત છબિ લિખધરી   મન મંદિર કે માંહિ
દેવા મેરી અરજી એક   સુનિયો દે કરી કાંન
નેહ નિભે સો કીજીયેં   કૃપા સિન્ધુ ભગવાન

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n24/mode/1up

1959-12-27 -Sandhyapath -by Valdas Maharaj - Manager of -Kachchhi Lalrameshwar Ashram (1148)

realpatidar.com

વાણી વચન વિલાસતે નહિ પાવે નિજ ભેવ
વિહારી વસ્તુ તો મિલે કૃપા કરે ગુરૂ દેવ
સેવારામ સેવા સંતકી કરે જુ મન ચિતલાઇ
સો પાવે મહામુક્તિ સુખ યામે સંશય નાહી
ગુરૂ કૃપા તેં પાઇયેં ચરન કમલ કી સેવ
સેવારામ મુખ બોલીયેં જય જય જય ગુરૂદેવ

ધ્વનિ

જય ગુરૂ દેવા જેઠીરામ રામસિંહ ગુરૂદેવ નમામ
હરસુર સ્વામી રણછોડરામ પરમાનંદ ગુરૂ એક અનામ
વિહારી ક્ષેમ ગુરૂ સેવારામ ગુરૂ ઇશ્વર સ્વામી પુંજારામ
અખંડાનંદ જય જય રામ સંતગુરૂ રામ પૂરન કામ
દત્ત દિગંબર જય રઘુનાથ ગુરૂવર સ્વામી શ્રીમુનિનાથ
હરિ નારાયણ ગુરૂ નારાયણ દ્વૈત નિવારણ પરમાનંદ
સદા શિવ શંકર ભકતજન પ્રિય પંકજ લોચન
નારાયણ નવ દાસોહં બોલો શ્રી દ્વારકાનાથ કી જય

ગુરૂ ગોસાંઈ કી જય

બાવા દેવા સાહેબ કી જય. વિહારી સાહેબ કી જય
શ્રી ક્ષેમસાગર કી જય, મહારાજ શ્રી ઇશ્વરરામજી કી જય
મહારાજ શ્રી લાલરામજી કી જય, મહારાજ શ્રી ઓધવરામજી કી જય
સાધ્વી મૈયા કી જય, ચાગ.બાઇ માત કી જય
ગંગા મઇયા કી જય, જમુના મઇયા કી જય
કેદારનાથ કી જય, બદ્રી-વિશાલ કી જય
અપને અપને ગુરૂ ગોસાંઇ કી જય, (સંધ્યા) આરતી કા જય સીતારામ

શ્રી સામદાસજી કૃત

શ્રી ગુરૂ ઇશ્વરરામજીની સ્તુતિ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1148/page/n25/mode/1up

realpatidar.com

દોહા

એક એવ અદ્વૈતજો પરમાત્મા જગદીશ
જન કારણ તનુ ધારિવર જય જય સદ્ગુરૂ ઇશ
મનહુ અપર બીરાજહી રઘુપતિ ગુરૂ મુનીશ
જ્ઞાન દાન નિત દેતવર જય જય સદ્ગુરૂ ઇશ
પૂરણ કામ નિષ્કામ મતિ સમજહિ રંક મહીશ
જ્ઞાનભાન મતિ માનઅતિ જય જય સદ્ગુરૂ ઇશ
સદા વિચારત લક્ષ જો તજી ભ્રમ ઇશ અનીશ
પુનિપુનિ ભાષત શિષ્ય પ્રતિ જય જય સદ્ગુરૂ ઇશ
દાતા જયોં નિજ મુકિતકે કરૂણા કારક શિશ
શરણ હરણ ભવ ભીતીભક્ષ જય જય સદ્ગુરૂ ઇશ
મોક્ષ કીયો જયોં આહુતે હરિ તતકાલં કરીશ
કીનો બંધ વિછેદ મમ જય જય સદ્ગુરૂ ઇશ
નિગમાગમ જેહી ગાવહી મન પર કહત મુનીશ
સોઇ લખાવત લક્ષ જો જય જય સદ્ગુરૂ ઇશ
નિજાનંદ નિમગ્ન જો વર વરીયાન વરીશ
જગ મંગલ કર બાશુદ્રગ જય જય સદ્ગુરૂ ઇશ
નિગમાગમ સબજાસુઉર વસત વદન વાગીસ
રિદ્ધિ સિદ્ધ રહત સોપાદતલ જય જય સદ્ગુરૂ ઇશ
સે હત સુઠીવર સુભગ પટ મનહુ માયા ધીશ
રમત રમાવત આપ સબ જય જય સદ્ગુરૂ ઇશ
શરનસુખદ ભય હરનભવ અધરન ધરન ગિરિશ
અશરન શરન ન અપર જન જય જય સદ્ગુરૂ ઇશ
મહિમા અગમ અગાધ અતિ બરણી ન શકત ફનીશ
શામ કહા એક મુખ બને જય જય સદ્ગુરૂ ઇશ
ઇશ્વર ઇશ્વર રૂપ હોઇ લીન મનુજ અવતાર
આદ્ય વરતર પૂજ્ય મમ નિજ જન કીન ઉદ્ધાર

સિયાવર રામચંદ્ર કી જય.
રાધેવર કૃષ્ણ દેવ કી જય.
પવનસુત હનુમાન કી જય.
બોલો ભાઇ સબ સંતન કી જય.

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n26/mode/1up

realpatidar.com

ભજન

જ્ઞાન ગંગામાં ન્હાને પ્રાણી   લઇને જાકમ જોળ
વવેક રૂપી વારીમાં તું   ન્હાને માથાબોળ—ટેક

સમજ શું નીર લઇને   કલશ ભરી ઢોળ
આનંદના તો ઓઘ વર્યા   તેની ઉડે છોળ—જ્ઞાન

વૈરાગ્યની માટી લઇને   મનને રગડોળ
ધોતાં ધોતાં ઉતરી જાસે   મેલડાની ખોળ—જ્ઞાન

વિશ્વ બધું ચાલી રહયું   મોહન ચકડોળ
બ્રહ્મ રસ પીધા વિના   ઉતરે નહિ મોહ—જ્ઞાન

ચિત ચિદ્રૂપ થયું   જાણે રંગ ચોળ
શોભે છે ભવાનીદાસ   શશીકળા સોળ—જ્ઞાન

આરતી

ૐ જય જગદીશ હરે   પ્રભુ જય જગદીશ હરે
ભકત જનોં કે સંકટ   ક્ષણમેં દૂર કરે —ૐ

જો ધ્યાવે ફળ પાવે   દુઃખ વિનસે મનકા
સુખ સંપતિ ઘર આવે   કષ્ટ મિટે તનકા —ૐ

માત પિતા તુમ મેરે   શરણ મહું કિસકી
તુમ બિન ઔર ન દુજા   આશ ધરૂં જીસકી —ૐ

તુમ પૂરન પરમાત્મા   તુમ અંતરયામી
પારબ્રહ્મ પરમેશ્વર   તુમ સબકે સ્વામી —ૐ

તુમ કરૂણા કે સાગર   તુમ પાલન કર્તા
મેં મુરખ ખલ કામી (મૈં સેવક તુમ સ્વામી) કૃપા કરો ભર્તા—ૐ

તુમ હો એક અગોચર   સબકે પ્રાણ પતિ
કિસ બિધ મિલું દયામય   તુમકો મૈં કુમતી —ૐ

દીન બન્ધુ દુઃખ હરતા   તુમ ઠાકુર મેરે
અપને હાથ ઉઠાવો   દ્વાર પડા તેરે —ૐ

વિષય વિકાર મિટાવો   પાપ હરો દેવા
શ્રધ્ધા ભકિત બઢાવો   સંતન કી સેવા —ૐ

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n27/mode/1up

realpatidar.com

આરતી

પહેલીરે આરતી ગણપતી દેવ તમારી
રિધ્ધ સિધ્ધ નારી આરતી ઉતારે તમારી
ભવો ભવ ભકિત દેજો દેવ મુરારિ
જન્મો જન્મ ભકિત દેજો કૃષ્ણ મુરારી

બીજીરે આરતી શંકર દેવ તમારી
ગંગાને પારવતી આરતી ઉતારે તમારી—ભવોભવ

ત્રીજીરે આરતી રામચંદ્ર દેવ તમારી
સતીરે સીતાજી આરતી ઉતારે તમારી—ભવોભવ

ચોથીરે આરતી હનુમત દેવ તમારી
સર્વે જગતમાં રહયા બાલ બ્રહ્મચારી—ભવોભવ

પાંચમીરે આરતી શ્રીકૃષ્ણ દેવ તમારી
રાધાને રુક્ષ્મણી આરતી ઉતારે તમારી—ભવોભવ

છઠ્ઠીરે આરતી શ્રીગંગા માત તમારી
સર્વે પ્રેમીજન આરતી ઉતારે તમારી—ભવોભવ

સાતમીરે આરતી શ્રીઓધવરામ દેવ તમારી
સર્વે ભકતજન આરતી ઉતારે તમારી—ભવોભવ

સ્તુતિ

શ્રી ગુરૂદેવ ઓધવરામ તમને વારંવાર પ્રણામ
તમને વારંવાર પ્રણામ પ્રભુછો અંતરના આરામ—ટેક

પાવન નામપવિત્ર તમારૂં ઉર અજ્ઞાન તિમિર હરનારૂં
એકજ ઠરવાનું છે ઠામ તમને વારંવાર પ્રણામ

સદ્‌ગુરૂ અદ્‌ભુત શકિત તમારી નિજ મહિમા કેરી બલિહારી
કીધાં પરોપકારી કામ તમને વારંવાર પ્રણામ

ઘટ-ઘટ જયોત તમારી ઝલકે તેજ તમારૂં સઘળે છલકે
ગુરૂછો સ્વયં જયોતિ સુખધામ તમને વારંવાર પ્રણામ

છે એક અચલની અરજી શ્રીગુરૂ પછી તમારી મરજી
આપો દર્શન પૂરણ કામ તમને વારંવાર પ્રણામ

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n28/mode/1up

realpatidar.com

શ્રી ગુરૂ ઉધ્ધવરામજી નિર્વાણાષ્ટક

જગવંદ્ય ભૂમિ વસુધાની મહીં
તાહી શીષ્ય ક્ષમાનીધિ ક્ષેમમહા
ગુરૂ ઇશ્વર ઇશ્વરરૂપ હતા
ભાલના ભાલે તો ભકિત ભરી
વાંઢાય વિહારીનું ક્ષેત્ર દીસે
નિત્ય તૃપ્ત રહે નિજ રૂપ વિશે
મુખાકૃતિ જોતાં જે મંદ હસે
બહુ કષ્ટ સહી નિજ કાય કસે

કચ્છ દેશ કુમારીકા ક્ષેત્ર વિષે
યોગી હતા અવધુત હતા
સમભાવી એ સંતનો સુરજ થઇ
આજે અસ્ત થયો જાણે રાત પડી
એતો સંત મહા મતિમંત હતા
માથે સિધ્ધની છાપ હતી તે છતાં
અવની તલ માંહી સદા તપતાં
ઉધ્ધવ સમ ઓધવરામ જતાં

કાષાય રકત ન પિત્ત કદી
વિરહાગ્નિમાં જીવ જે ઝુરી મરે
મહામોહ નિશાવશ માનવના
ત્રિગુણાતિત મોહનો નાશ કરી
શુધ્ધ સત્વગુણે પટ શ્વેત ધર્યા
એને ઉધ્ધવ સમ ઉપદેશ કર્યા
ભાનુકુળ ભાણે તિમિર હર્યા
અવિનાશીના ઉત્તમ ઠામે ઠર્યા

નિજ પ્રાણથી પ્યારા ગુરૂકુળમાં
સદવિધા તણાં જેણે દાન દીધાં
વળી અંધ, અપંગ, અનાથ તણો
અહા! આજે એ ઓધવરામ નથી
ગુરૂ ઇશ્વરરામની યાદ ભરી
જગવંદ્ય યતિવર જોગ ધરી
ઉધ્ધાર કર્યાની તો ખંત ખરી
ક્રુર કાળે કસોટી આ કેવી કરી

ઉત્તરાપથમાં હરદ્વાર વિષે
નિજ રૂપમાં પૂરણ મસ્ત બની
શુભ કર્મ કુઠારની ધારે કરી
જ્યારે જીવનેશિવ બે એૈકય થયા
ઉપરામ વૃતિ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ
કરી ગંગ કિનારપે પર્ણકુટિ
દુષ્ટ કર્મ રૂપી ગયું કાષ્ટ કુટી
જગ જંજીર પ્રાયે ગઇ છે છુટી

નિજ આશ્રમ આવીને અન્ત સમે
વદે દાસ દયાળ દયાનિધીના
અમરાપુર ઓધવરામ વર્યા
ચરણોદક ધોઇને ચંદુ કહે
અમને પણ આપે કૃતાર્થ કીધા
અમે અંકમાં શીશ સમર્પી દીધાં
એ સંત બનીને સ્વયં સીધ્ધા
ચરણામૃત ઇતો મેં પ્રેમે પીધાં

ધન્ય ધામ ધરા પુરી માત પિતા
કચ્છ દેશ તણી ધરણી ધન્ય હો
ધન્ય સંત સમાગમ જેણે કર્યો
ધન્ય ઓધવરામ તણો જય હો
ધન્ય ગામ જેમાં તમે જન્મધર્યો
કૃપા નિધી તણા કુળને ધન્ય હો
ધન્ય સંતનો જે કોઇ શિષ્ય બન્યો
જયહો, જયહો, જયહો, જયહો.

પાદુકા પ્રતિષ્ઠા મહોત્સવ,
રામ નવમી, સાં ૨૦૧૩,
ઇશ્વરનગર (વાંઢાય).

કર્તા, ચંદ્રસિંહજી રતનસિંહજી જાડેજા
મેરાઉ, કચ્છ (તાલુકો માંડવી)

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n29/mode/1up

realpatidar.com

ૐ

આવાહનં ન જાનામિ, ન જાનામિ તવાર્ચનમ્
પુજાં ચૈવં ન જાનામિ, ક્ષમસ્વ પરમેશ્વર:
અન્યથા શરણું નાસ્તિ, ત્વમેવ શરણં મમ:
તસ્માત્ કારૂણ્ય ભાવેન, રક્ષ રક્ષ મહેશ્વર
ગતં પાપં ગતં દુ:ખં, ગતં દારિદ્રમેવ ચ
આગતા સુખ સંપતિ:, પુણ્યોહં તવ દર્શનાત
મંત્ર હીનં ક્રિયા હીનં, ભક્તિ હીનં જનાર્દન:
યત પૂજિતં મયા દેવ, પરિપૂર્ણં તદસ્તુ મે
યદક્ષર પદ ભ્રષ્ટં, માત્રા હીનં ચ યદ ભવેત
તત: સર્વં ક્ષમ્યતાં દેવ, પ્રસીદ પરમેશ્વર
વંદે દેવ ઉમાપતિં સુરગુરૂં વંદે જગત કારણં
વંદે પન્નગ ભુષણં મૃગધરં વંદે પશુનાં પતિ
વંદે સુર્ય શશાંક વહ્નિનયનમ: વંદે મુકુંદ પ્રિયમ્
વંદે ભકતજનાશ્રયંચ વરદં; વંદે શિવં શંકરમ્
અચ્યુતં કેશવં શ્રીરામનારાયણં, શ્રીકૃષ્ણ દામોદરં વાસુદેવં હરિં.
શ્રીધરં માધવં ગોપિકા વલ્લભં, જાનકી નાયકં શ્રીરામચંદ્ર ભજે.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ
ૐકારં બિંદુ સંયુકતં. નિત્યં ધ્યાયન્તિ યોગિન:
કામદં મોક્ષદં ચૈવ, ૐકારાય નમો નમ:
વસુદેવ સુતં દેવં, કંસ ચાણુર મર્દનમ્
દેવકી પરમાનંદમ્ કૃષ્ણં વંદે જગદ્ગુરૂં
મૂકં કરોતી વાચાલં, પંગું લંઘયતે ગિરિમ્
યત કૃપા તમહં વંદે, પરમાનંદ માધવમ્

અસિતગિરિસમં સ્યાત કજ્જલં સિંધુ પાત્રે,
સુરતરૂવર શાખા લેખિની પત્ર ઉર્વી.
લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વ કાલમ્,
તદપિ તવ ગુણાનામીશ પારંન યાતિ ॥

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n30/mode/1up

realpatidar.com

ભજન

ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા ગાતે જાતે મગમેં હરેકૃષ્ણ રામા
ગાતે જાતે મગમેં હરેકૃષ્ણ રામા ગાતે જાતે મગમેં હરેકૃષ્ણ રામા

કાંધ દોરીઓં, લેટા લટકાયે કાંખ ચવલકી પુટકી દબાયે
ચલે ફિરે ફિરે પહોંચે હરિ ધામા ગાતે જાતે મગમેં હરેકૃષ્ણ રામા

દુત જાકર સંદેશા સુનાયે છોડ આસન ત્રીલોકી હૈ ધાયે
આંસુઅનજલ વિપ્ર ચરણ ધોયે ઘનશ્યામા ગાતે જાતે મગમેં હરેકૃષ્ણ રામા

વિવિધ ભોજન સે તૃપ્તી કરાયે સુવર્ણ આસનપર મિત્રકો સુલાયે
દાબે હરિ પાંયે, પંખજલે સત્યભામા ગાતે જાતે મગમેં હરેકૃષ્ણ રામા

ભાભીને ભેટ દી કથા બતાઓ મિત્ર હમસેના કુછભી છુપાઓ
તાંદુલ ચબાએ હરિ દીયો રતનધામા ગાને જાતે મગમેં હરેકૃષ્ણ રામા
હો ગયા મહયા રતન મણિ ધામા ગાતે જાતે મગમેં હરેકૃષ્ણ રામા

realpatidar.com

https://archive.org/details/bk1148/page/n31/mode/1up

realpatidar.com

realpatidar.com